



સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા)

ઈસરો સામે, સેટેલાઈટ રોડ, અમદાવાદ, ગુજરાત ૩૮૦ ૦૧૫

ફોન : (079) 2674 7612-36 ફેક્સ : (079) 2674 9048

www.spipa.gujarat.gov.in

કેન્દ્ર સરકારની કચેરીઓ અને જાહેર સાહસોની ભરતી પરીક્ષા (class 1-2) પ્રશિક્ષણવર્ગો ૨૦૧૮- ૧૯

પરીક્ષા ઓનલાઇનને બદલે ઓફ લાઇન લેવાની હોઇ જરૂરી સુચના

(ક્રમાંક: સીજીઆરએસ-તાલીમ/૨૦૧૮-૧૯/પ્રવેશ પરીક્ષા-૦૧/ઇડીપી)

સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા, અમદાવાદ ખાતે કેન્દ્ર સરકારની કચેરીઓ અને જાહેર સાહસોમાં વર્ગ ૧-૨ની ભરતીના કામે આઇ.બી.પી.એસ., આર.બી.આઇ., એસ.બી.આઇ., એલ.આઇ.સી., એસ.એસ.સી., આર.આર.બી., વગેરે જેવી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના પ્રશિક્ષણવર્ગો ૨૦૧૮-૧૯ માટેની પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવેલ કે જેની પ્રવેશ પરીક્ષાની સંભવિત તારીખ ૦૮/૦૭/૨૦૧૮ રાખવામાં આવેલ વહીવટી કારણોસર પ્રવેશપરીક્ષા મુલતવી રાખવામાં આવેલ હતી. આ પ્રવેશ પરીક્ષા ઓન લાઇનને બદલે હવે ઓફ લાઇન લેવાનું નક્કી કરવામાં આવે છે. જેનો કાર્યક્રમ નીચે મુજબ નક્કી કરવામાં આવેલ છે. આ પ્રવેશ પરીક્ષા માટે અરજી કરી, ફી ભરનાર સંબંધિત ઉમેદવારે આ બાબતની નોંધ લેવા તેમજ આ બાબતે સંસ્થાની વેબસાઇટ <https://spipa.gujarat.gov.in> અને ઓજસની વેબસાઇટ <https://ojas.gujarat.gov.in> ચકાસતા રહેવા જણાવવામાં આવે છે.

અ.નં	પરીક્ષાના આયોજન અંગેની વિગત	નક્કી થયેલ તારીખ
૧	પ્રવેશ પરીક્ષા માટેની હોલ ટીકીટ ડાઉનલોડ કરી મેળવવા માટેની તારીખ	તા.૨૭/૦૮/૧૮ થી તા.૦૨/૦૯/૧૮ (સવારના ૧૧.૦૦ વાગ્યા સુધી)
૨	પ્રવેશ પરીક્ષાની તારીખ	તા.૦૨/૦૯/૨૦૧૮(રવિવાર) ૧૧.૦૦ થી ૧૩.૦૦

૧. ઓફ લાઇન પરીક્ષા અંગેની ખાસ સૂચનાઓ:-

1. આ સંસ્થા દ્વારા આપવામાં આવેલ મુળ જાહેરાતમાં જ્યાં ઓન લાઇન પરીક્ષા લખવામાં આવેલ છે. તે રદ કરી ઓફ લાઇન પરીક્ષા વાંચવા આથી સુધારો કરવામાં આવે છે.
2. પ્રશ્નપત્ર - ૨૦૦ માર્ક્સનું રહેશે. પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના (Multiple Choice Questions) રહેશે.
3. પ્રશ્નોના જવાબો અલગ આપેલ ઉત્તરવહીમાં જ લખવાના રહેશે. જવાબો કાળી/વાદળી બોલ પોઇન્ટ પેનથી ફક્ત (●) કરીને આપવાના છે. પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી અને અંગ્રેજી રહેશે. ગુજરાતી ભાષાંતરમાં કોઇ ગુંચવણ જણાય તો અંગ્રેજીમાં પૂછાયેલ પ્રશ્નની ભાષાનું અર્થઘટન આખરી ગણાશે.
4. ઉત્તરવહીમાં જવાબ આપવા માટે માત્ર કાળી/વાદળી બોલ પોઇન્ટ પેનનો જ ઉપયોગ કરવાનો હોઇ. ઉમેદવારે ત્રણ થી ચાર કાળી/વાદળી બોલ પોઇન્ટ પેન સાથે અવશ્ય લાવવી.
5. પ્રશ્નપત્રમાં મહંદઅંશે નીચેના વિષયો આવરી લેતા પ્રશ્નો પૂછવામાં આવશે.

તારીખ	સમય	વિષય	ગુણ
૦૨-૦૯-૨૦૧૮	૧૧-૦૦ થી ૧૩-૦૦	(૧) કોન્ટીટેટીવ એપ્ટીટ્યુડ	૫૦
		૨) વર્બલ અને નોન વર્બલ રીઝનીંગ	૫૦
		(૩) ઇંગ્લીશ (અંગ્રેજી)	૫૦
		(૪) જનરલ અવરનેસ અને કરન્ટ અફેર	૫૦
કુલ ગુણ			૨૦૦

પ્રવેશ પરીક્ષા માટેનું કેન્દ્ર: વિગતવાર કેન્દ્રની જાણ પ્રવેશપત્ર (Hall Ticket) ઉમેદવાર

<https://ojas.gujarat.gov.in> વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકશે.

6. ઉત્તરવહીમાં નિયત જગ્યાએ બેઠક નંબર, પ્રશ્ન પત્ર બુકલેટ સીરીઝ અને કેટેગરી (Category) અવશ્ય લખવી.
7. ઉત્તરવહીમાં જવાબ માટે બોલપોઇન્ટથી કરેલ નિશાની સિવાયનું (●) કોઇપણ પ્રકારનું લખાણ અથવા એક કરતાં વધુ વૈકલ્પિક ઉત્તરો ગુણને પાત્ર થશે નહીં.

8. ઉત્તરવહી ઉપર નિરીક્ષકની સહી છે કે નહીં તેની ખાત્રી કરી લેવી. જો તમારી ઉત્તરવહી ઉપર નિરીક્ષકની સહી નહીં હોય તો તેવી ઉત્તરવહી મૂલ્યાંકન માટે ગણાશે નહીં.
9. ખોટા જવાબ બદલ અથવા એક પ્રશ્નમાં એક કરતાં વધારે જવાબ બદલ પ્રશ્નના ગુણના ૩૩% ગુણ બાદ કરવામાં આવશે. જે પ્રશ્નનો જવાબ આપવામાં નહીં આવે તેના માટે કોઈ ગુણની કપાત કરવામાં આવશે નહીં.
10. ઉમેદવારે સાચો બેઠક નંબર, પ્રશ્ન પત્ર બુકલેટ સીરીઝ અને અરજીમાં દર્શાવેલ કેટેગરી ઉત્તરવહીમાં અવશ્ય દર્શાવવાની રહેશે. અધુરી વિગત વાળી ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવશે નહીં. અને આ અંગેની તમામ જવાબદારી ઉમેદવારની રહેશે.
11. સંસ્થા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ મુળ જાહેરાતના મુદા નં.૧૦:-“ પ્રાથમીક કસોટી માટેના પ્રશ્ન પત્ર અંગેની ખાસ સુચનાઓ ” ના મુદા નં. ૨ અને ૧૦ થી ૧૪ હવે ધ્યાને લેવાના રહેશે નહીં.
12. આ ઉપરાંત મુળ જાહેરાતમાં આપવામાં આવેલ અન્ય તમામ સુચનાઓ યથાવત રહેશે.

તા.૦૨/૦૮/૨૦૧૮
સ્થળ:- અમદાવાદ

સહિ(કે.એમ.ભીમજીયાણી, IAS)

નાયબ મહાનિર્દેશક
સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા,
અમદાવાદ